

રાજકોટ મહાનગરપાલિકા

ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ

-: અખબારી યાદી:-

૨૧ જુન વિશ્વ યોગ દિનની દિવ્ય ઉજવણીમાં સામેલ થવા મેયરશ્રી બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકરનો લોકોને અનુરોધ

વિશ્વ યોગ દિનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે: ફોર્મ તમામ વોર્ડ ઓફીસથી પણ મળશે અને ૧૯ જુન સુધીમાં પરત કરવાના રહેશે.

તા. ૧૫-૬-૨૦૧૯

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. જે અનુસંધાને આગામી ૨૧ જુન ૨૦૧૯ના રોજ પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વ યોગ દિનની ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છુક લોકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે જેનો સૌ નાગરિકો લાભ લઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફીસ, સિવિક સેન્ટરએથી રજીસ્ટ્રેશન માટેના ફોર્મ મળશે, જે ફોર્મ ૧૯ જુન સુધીમાં પરત કરવાના રહેશે. રજીસ્ટ્રેશન થયેલ ફોર્મના તમામ લાભાર્થીઓને રાજકોટ મહાનગરપાલિકા તરફથી સર્ટીફિકેટ આપવામાં આવશે. ભારતની અદભૂત સંસ્કૃતિને સમગ્ર વિશ્વે અદકેરો આદર આપ્યો છે ત્યારે ભારતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીનો અનેરો થનગનાટ હોય તે સ્વાભાવિક છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં યોજનાર યોગ કાર્યક્રમ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે ઇચ્છુક નાગરિકો

http://rmc.gov.in/rmcwebsite/frm_yoga_registration.aspx

આ લિંક પર નાગરિકો રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગણી, ઇંડક અજયભાઈ પરમાર અને આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.

યોગની ઉજવણીમાં દીવ્યાંગો, થેલેસેમિયા, અને ડાયાબીટીસ ધરાવતા લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ યોગમાં ભાગ લેવા માટે યોગમાં જોડાનારએ ચદ્દાઈ સાથે લાવાની રહેશે. એકવા યોગમાં ભાગ લેનાર બહેનોને મહાપાલિકા વતી સ્વીમિંગ કોસ્યુચુમ આપવામાં આવશે. યોગથી આરોગ્ય તંદુરસ્ત રહે છે અને શરીરમાં નવો સંચાર ઉત્પન થાય છે. આજના દોડધામના સમયમાં યોગથી તન,મનને શાંતિ મળે છે. જેથી ૨૧ જુન ૨૦૧૯ના રોજ રાજકોટ શહેરના તમામ શહેરીજનોને ભાગ લેવા અપીલ કરેલ છે.

૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સયુંકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભાને સંબોધતી વખતે માન. પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરતા તા.૧૧ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ સયુંકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા કરવામાં આવેલ ઠરાવ અનુસંધાને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. જે ભારત માટે અત્યંત ગૌરવની વાત છે.

(જન સંપર્ક અધિકારી)